

પ્રિય મિત્ર,

૧લી મે એટલે દરેક ગુજરાતી માટે ગૌરવશાળી દિવસ. આ દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ઈ.સ. 1960માં મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતને અલગ કરી એક નવા રાજ્યની સ્થાપના પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી તેથી આ દિવસ 'ગુજરાત સ્થાપના દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. આજે સમગ્ર દેશના આર્થિક વિકાસમાં ગુજરાતનું ખૂબ યોગદાન રહ્યું છે. આપણું 'ગુજરાત રાજ્ય' સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય ગણાય છે. વિશ્વભરમાં લોકપ્રિય ગુજરાતી ભાષાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ 'ગુજરાતીલેક્સિકન' વેબસાઇટ આ વર્ષે ગુજરાત દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે વિવિધ રજૂઆત કરી રહ્યું છે. આ દિવસે પ્રસિદ્ધ રેડિયો જોકી ધ્વનિત અમદાવાદ બુક-ફેરમાં કરશે Explore Gujaratનું લોકાર્પણ જેની વિગતો નીચે મુજબ છે :

એક્સ્પ્લોર ગુજરાત - ગુજરાતને જાણો અને માણો

ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા વિશાળ અને ભવ્ય ભારતદેશમાં ગુજરાત એક અનોખું અને અલગ તરી આવતું રાજ્ય છે. તેની અનેક વિશેષતાઓ અને વિવિધતાઓ છે. ગુજરાત રાજ્ય વિશેની , તેની સંસ્કૃતિ, તહેવારો-ઉત્સવો, પુસ્તકો, મનોરંજન જગત , ભોજન, ગરવા ગુજરાતી , ઉદ્યોગો વગેરે જેવી માહિતીને વિશ્વના લોકો સમક્ષ રજૂ કરવાના આશયથી ગુજરાતીલેક્સિકન દ્વારા 'એક્સ્પ્લોર ગુજરાત'ની સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં પ્રથમ તબક્કે આપ ગુજરાત વિશેની, ગુજરાતી પુસ્તકો વિશેની તથા ગુજરાતી ફિલ્મ અને નાટક વિશેની માહિતી મેળવી શકશો અને તે પણ ગુજરાતીમાં. આ બાબતો દરેક ગુજરાતી અથવા બિનગુજરાતીને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. સમયાંતરે આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં પણ મેળવી શકાશે.

તો ચાલો ગુજરાતને માણો આ લિંક ઉપરથી : www.gujaratilexicon.com/explore-gujarat

રાષ્ટ્રીય પુસ્તક મેળો - અમદાવાદ

દર વર્ષે ગુજરાતમાં અમદાવાદ મુકામે 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. 'ગુજરાતીલેક્સિકન' ટીમ પણ આ પુસ્તક મેળામાં ભાગ લેવાની છે. આ પુસ્તક મેળા દ્વારા આપ અમારી મુલાકાત લઈ શકો છો. અમારો સ્ટોલ નંબર છે - 150 . આપની રૂબરૂ મુલાકાત દ્વારા ગુજરાતીલેક્સિકનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને લાક્ષણિકતાઓ વિશે આપને જણાવતાં અમને આનંદ થશે.

ટાઇપિંગ માસ્ટર

ભાષા તથા વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી અને ચોકસાઈપૂર્વકનું તથા ક્ષતિ રહિત ટાઇપિંગ એક ઉપયોગી અને આવશ્યક કૌશલ્ય ગણાય છે. આ આવશ્યકતાને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવેલ 'ટાઇપિંગ માસ્ટર' સેવા આપને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ટાઇપિંગ ઝડપથી તથા ચોકસાઈપૂર્વક કરતાં શીખવશે. આની મદદથી આપ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ટાઇપ કરતાં શીખી શકશો તથા તમારી ટાઇપની ઝડપ , ચોકસાઈ વગેરેની ચકાસણી કરી શકશો. અહીં આપ વાક્યો અને ફકરા એમ બે સ્વરૂપે ટાઇપિંગનો અભ્યાસ કરી શકશો. તો

આજે જ, સાથેની લિંક દ્વારા મુલાકાત લો અમારા આ ખાસ નવા વિભાગની અને આપના ટાઇપિંગ કૌશલ્યને ખીલવો

www.gujaratilexicon.com/typing

ગુજરાતી ભાષા પાયાથી શીખવતી મોબાઇલ એપ્લિકેશન - LLG

વિશેષતઃ ૧લી મે , ૨૦૧૫ના ગુજરાત સ્થાપના દિનને વિશેષ ગૌરવ અપાવતાં ગુજરાતી ભાષાના સ્વર, વ્યંજન, સંખ્યાઓ, શબ્દભંડોળ વગેરે પાયાગત બાબતોનો પરિચય કરાવતી અને શીખવતી મોબાઇલ એપ્લિકેશન Lets Learn Gujarati આપની સમક્ષ મૂકતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. અહીં આ બધી બાબતોની રજૂઆત સચિત્ર, દૃશ્ય-શ્રાવ્ય અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવેલ છે જે કોઈ પણ વ્યક્તિને ગુજરાતી ભાષા શીખવામાં મદદરૂપ અને ઉપયોગી સાબિત થશે. આજે જ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ઉપર કાર્યરત અમારી આ એપ્લિકેશન, સાથેની લિંક દ્વારા ડાઉનલોડ કરો અને સરળતાથી ગુજરાતી ભાષા શીખો :

<https://play.google.com/store/apps/details?id=com.arnion.letslearngujarati>

શબ્દકોશ અને સુવિચારોની મોબાઇલ એપ્લિકેશન

માઇક્રોસોફ્ટ દ્વારા ભલામણ કરાયેલ અમારી વિન્ડોઝ પ્લેટફોર્મ ઉપર કાર્યરત શબ્દકોશ એપ્લિકેશનમાં આપ હવે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી અને ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ વિના મૂલ્યે મેળવી શકો છો : લિંક:

<http://www.windowsphone.com/en-in/store/app/shabdakosh-gujaratilexicon/73c2fdd2-936c-4726-ae3b-e6e53ef182be>

આ ઉપરાંત પ્રેરણાદાયી સુવિચારોની એક નવી એપ્લિકેશન પણ આપ ડાઉનલોડ કરી શકો છો અને તે સુવિચારો આપના સ્નેહીસંબંધીઓને વહેંચી શકો છો :

<http://www.windowsphone.com/s?appid=e85b6d22-9505-4041-872d-34b7a5689ae5>

લોકકોશનો નવો અવતાર

ભાષાપ્રેમી લોકોના સહયોગથી કાર્યરત થયેલો ડિજિટલ શબ્દકોશ એટલે લોકકોશ. અત્યાર સુધી લોકસહકાર દ્વારા મળેલા શબ્દોમાંથી 1026 શબ્દો લોકકોશ ઉપર મૂકવામાં આવ્યા છે. લોકકોશના કલેવરમાં ફેરફાર કરી આજે લોકો સમક્ષ તેને રજૂ કરવામાં આવેલ છે. આજે જ લોકકોશની વેબસાઇટની મુલાકાત લો અને શબ્દમિત્ર બની નવા શબ્દો ઉમેરો. આશા છે કે આપને લોકકોશનું નવું રૂપ જરૂરથી ગમશે.

lokkosh.gujaratilexicon.com

વધુ વિગતો જાણવા આપ અમને maitri@arniontechnologies.com Or deval@arniontechnologies.com ઉપર ઈમેલ કરી શકો છો અથવા મૈત્રી શાહ (9825263050), દેવલ તલાટી (9925242480)નો સંપર્ક કરી શકો છો.